

કોઈ પણ મિલકતના નિરીક્ષણ દરમિયાન અમારા સાથીઓ અને ઘરના નિવાસીઓની સુખાકારી હંમેશાં મહત્વની છે, પરંતુ **COVID-19** મહામારી દરમિયાન અમે અમારા સર્વેયરો અને નિવાસીઓને વધારાની સાવધાની લેવા માટે કહીશું. તમે અહીં આની અપેક્ષા રાખી શકો છો:



આ નિરીક્ષણ પૂર્વે

અમારા સર્વેયર અપોઇન્ટમેન્ટની પુષ્ટિ કરવા માટે તેઓ આવે તે પહેલાં આશરે 30 મિનિટ પહેલાં તમારો સંપર્ક કરશે. તમને મિલકત વિશે થોડા પ્રશ્નો પૂછવામાં આવશે અને અપોઇન્ટમેન્ટ નિર્ધારિત થઈ ત્યારથી માંડીને સંજોગોમાં કોઈ પણ ફેરફારો અંગે પુષ્ટિ કરવાનું કહેવામાં આવશે. દાખલા તરીકે:

- "ઘરમાં કોઈ વ્યક્તિને છેલ્લા 14 દિવસોમાં COVID-19 થયો છે?"
- "મિલકતમાં કોઈ વ્યક્તિને COVID-19નાં લક્ષણો જણાયાં છે અથવા હજી સુધી ઘરમાં સ્વ-એકાંતવાસનો જરૂરી સમયગાળો પૂરો કર્યો ન હોય એમ બન્યું છે?"
- "શું તમને અથવા તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિને COVID-19નાં લક્ષણો જણાયાં હતાં?"
- "મિલકતમાં એવી કોઈ વ્યક્તિ છે જે વધુ જોખમના વર્ગ/શિલ્ડિંગમાં આવી શકે/હોય?" જો આમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ 'હા' હોય તો અમે નિરીક્ષણ ચાલુ રાખી શકીશું નહિ અને અમારે અપોઇન્ટમેન્ટ ફરીથી ગોઠવવી પડશે.



સર્વેયર આવે તે પહેલાં:

- કૃપા કરીને મિલકતના નિરીક્ષણના અવધિ માટે કોઈ પણ બિલાડીઓ કે ફૂતરાં તમારી સાથે રાખો
- શક્ય હોય તો બધી બારીઓ ખોલીને મિલકતમાં હવાઉજાસ કરો
- જેને અડવામાં આવે તેવી સપાટીઓની સંખ્યા ઓછી કરવા માટે:
 - અંદરનાં અને બહારનાં બારણાંનાં બધાં હેન્ડલો લૂછીને સ્વચ્છ કરવાના રહેશે
 - બધાં બારણાં અને લોફ્ટ હેચીઝ ખોલવાનાં રહેશે, જેમાં દાદરા નીચેના કબાટ અને હવાના સંપર્કમાં આવતા કબાટનો પણ સમાવેશ થાય છે
 - બધા રૂમોમાં લાઇટો ઓન કરવાની રહેશે.



નિરીક્ષણ દરમિયાન

જ્યારે સર્વેયર આવે ત્યારે તમને 2 મીટરના સામાજિક અંતરના નિયમો જાળવવાનું કહેવામાં આવશે.



અમારા સર્વેયર PPE અથવા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (ફેસ માર્સ્ક અને ડિસ્પોઝલ ગ્લોઝ) પહેરીને શારીરિક નિરીક્ષણ પૂરું કરશે, ઉપકરણ સાફ કરવા માટે હેન્ડ વાઇપ્સનો ઉપયોગ કરશે અને આખા દિવસ દરમિયાન હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરશે.



જ્યારે સર્વેયર આવે ત્યારે તો 'ગતિશીલ અથવા દૃષ્ટિગત જોખમ મૂલ્યાંકન' હાથ ધરશે અને જો તેઓને કોઈ જોખમ હોવાનું જણાય તો તેઓ નિરીક્ષણ અટકાવી શકે છે.



જ્યાં શક્ય હોય ત્યાં સર્વેયર મિલકતનું નિરીક્ષણ કરતા હોય તે દરમિયાન તમને બાગ અથવા અન્ય સામાજિક વિસ્તારમાં રાહ જોવાનું કહેવામાં આવશે. જો તમે બાગમાં અથવા રસ્તા પર રાહ જોઈ શકો તેમ ન હો તો સર્વેયર જ્યાં સુધી નિરીક્ષણ પૂરું ન કરી લે ત્યાં સુધી તમને એક અલગ રૂમમાં રહેવાનું કહેવામાં આવશે.



સર્વેયર 30 મિનિટ સુધી મિલકતમાં રહે તેવી સંભાવના છે, પરંતુ મિલકતના ગુણધર્મોના આધારે તેઓ વધુ સમય માટે તમારી સાથે રોકાઈ શકે તે શક્ય છે.



કૃપા કરીને નિરીક્ષણ પૂર્વે સર્વેયરને તમામ PPE / ઉપકરણ તૈયાર કરવા માટે અને નિરીક્ષણ બાદ બધી વસ્તુ સાફ કરવા અને સેનિટાઇઝ કરવા માટે સમય આપો.



ફરીથી, જે સપાટીઓને અડવામાં આવે તેની સંખ્યા ઓછી કરવા માટે સર્વેયર તમારી મિલકતમાંથી બહાર જતી વખતે કોઈ બારણાં બંધ કરશે નહિ, પરંતુ તેઓ જ્યારે બહાર જાય ત્યારે તમને જાણ કરશે.



કૃપા કરીને ખોટું લગાડશો નહિ, પરંતુ દુર્ભાગ્યે અમારા સર્વેયરો નિરીક્ષણ દરમિયાન કોઈ પીણું લઈ શકશે નહિ.